

YRDSB વર્ચ્યુઅલ સ્કૂલ ટ્રાન્સફર ફોર્મ

પ્રિય પરિવારો,

અમે આશા રાખીએ છીએ કે તમારા બાળકોનો માર્ચ બ્રેક સલામત અને આનંદપ્રદ હતો. અમે આગામી શાળા-વર્ષ માટે સક્રિયપણે આયોજન કરી રહ્યા છીએ, અને જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ હવે શાળામાં રુબરુ (સન્મુખ) હાજરી આપી રહ્યા છે, ત્યારે અમે માન્ય કરીએ છીએ કે કેટલાંક પરિવારો તેમના બાળક માટે ઓનલાઇન શિક્ષણ યાવુ રાખવા ઇચ્છતા હોઇ શકે છે. ઓન્ટારિયો સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે સ્કૂલ બોર્ડ 2022-2023 શાળા-વર્ષ માટે વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ શિક્ષણની ઓફર કરવાનું યાવુ રાખવું જોઈએ. તદ્દનુસાર, 2022-2023 શાળા-વર્ષ માટે YRDSB એલિમેન્ટરી વર્ચ્યુઅલ સ્કૂલ (EVS) અને સેકન્ડરી વર્ચ્યુઅલ સ્કૂલ (SVS) દ્વારા રુબરુ (F2F) અને વર્ચ્યુઅલ શિક્ષણ પ્રદાન કરે છે. અમારી યોજનાઓમાં આવતા વર્ષે મિશ્ર શિક્ષણનો સમાવેશ થતો નથી.

જો તમારું બાળક આવતા વર્ષે રુબરુ (સન્મુખ) શાળાએ જવાનું હશે, તો કોઈ પગલાંની જરૂર નથી.

જો તમે ઇચ્છતા હોવ કે તમારું બાળક 2022-2023 શાળા વર્ષ માટે વર્ચ્યુઅલ શાળામાં જાય, અથવા અમારી વર્ચ્યુઅલ શાળાઓ વિશે વધુ માહિતી ઇચ્છતા હોવ, તો કૃપા કરીને આગળ વાંચો.

પ્રાથમિક વર્ચ્યુઅલ શાળા

ઓનલાઇન શાળામાં જતા વિદ્યાર્થીઓ માટે:

- વિદ્યાર્થીઓને દૈનિક સમયપત્રક પ્રાપ્ત થશે જે સામાન્ય શાળાના દિવસને અનુસરે છે જેમાં રિસેસ (વિરામ) અને બપોરના ભોજનનો સમય સામેલ છે.
- શિક્ષણ ઓન્ટારિયો અભ્યાસક્રમને અનુસરશે અને નિયમિત વર્ગખંડ જેવી જ શિક્ષણ પદ્ધતિને અનુસરશે જેમ કે નાના અને મોટા જૂથમાં ભણવાની તકો, વિદ્યાર્થીઓ તેમના શિક્ષક અને સહપાઠીઓ સાથે સંકળાયેલા હોય.
- કિન્ડરગાર્ટનના વિદ્યાર્થીઓ** પાસે 300-મિનિટના વાસ્તવિક સમયના દિવસમાં ઓછામાં ઓછી 180 મિનિટ, એક શિક્ષક અને નિયુક્ત પ્રારંભિક બાળપણ શિક્ષક - ડેઝિગ્નેટેડ અર્લી યાઇલ્ડહુડ એજ્યુકેટર (DECE) સાથે જીવંત (સુમેળયુક્ત) શિક્ષણ હશે. બાકી રહેલો કોઈપણ સમય અસુમેળ (જીવંત નહીં) શીખવાનો હશે.
- ધોરણ 1-8ના વિદ્યાર્થીઓ** પાસે શિક્ષક સાથે વાસ્તવિક સમયના, 300-મિનિટના દિવસમાં ઓછામાં ઓછી 225 મિનિટ જીવંત (સુમેળયુક્ત) શિક્ષણ હશે. બાકી રહેલો કોઈપણ સમય અસુમેળ (જીવંત નહીં) શીખવાનો હશે.
- વિદ્યાર્થી/કુટુંબની રુચિ અને સ્ટાફની જરૂરિયાતોને આધારે જો શક્ય હોય તો 2022-2023માં ફ્રેન્ચ નિમજ્જન પ્રોગ્રામિંગ પ્રદાન કરવામાં આવી શકે છે. જો ઓફર કરવામાં આવે તો, ફ્રેન્ચ ઇમર્સન વર્ગોમાં બહુવિધ ધોરણના વિદ્યાર્થીઓ સામેલ હોઈ શકે છે. ફ્રેન્ચ ઇમર્સન વર્ચ્યુઅલ રીતે ઉપલબ્ધ ન હોય એવા પ્રસંગે, વિકલ્પોની ચર્ચા કરવા માટે તમારી વર્તમાન શાળા દ્વારા તમારો સંપર્ક કરવામાં આવશે. ટ્રાન્સફર ફોર્મ બંધ ન થાય ત્યાં સુધી, અમે ખાતરી આપી શકતા નથી કે આ વૈકલ્પિક પ્રોગ્રામ પ્રદાન કરવામાં આવશે. ફ્રેન્ચ ઇમર્સન F1 વર્ચ્યુઅલ રીતે ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં, તમારું બાળક આવતા વર્ષે (2023-2024) રુબરુ F1 પ્રોગ્રામમાં ફરીથી પ્રવેશ કરી શકશે.
- દ્વિતીય ભાષા તરીકે અંગ્રેજી (ESL) કાર્યક્રમની આવશ્યકતા ધરાવતા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાની સહાયની સુલભતા હશે.

- **વિશિષ્ટ શિક્ષણની જરૂરિયાતો** ધરાવતા વિદ્યાર્થીઓને સહાય કરવી એ બંને શિક્ષણ મોડલમાં પ્રાથમિકતા છે. સ્પેશિયલ એજ્યુકેશન સ્ટાફ બંને મોડલમાં વિદ્યાર્થીઓને સહાય આપવાનું ચાલુ રાખશે. સપ્ટેમ્બરમાં, વર્ચ્યુઅલ સ્કૂલ દ્વારા, IEP ધરાવતા વિદ્યાર્થીઓના પરિવારોનો તેમના બાળકના IEP પર પરામર્શ માટે સંપર્ક કરવામાં આવશે. સ્પેશિયલ એજ્યુકેશન કોમ્યુનિટી ક્લાસમાં વિદ્યાર્થીઓના પરિવારોનો તેમની વર્ચ્યુઅલ સ્કૂલ દ્વારા ગૂગલ ક્લાસરૂમ અને ઓન-લાઇન મીટિંગની વિગતો સાથે સંપર્ક કરવામાં આવશે.

વધુ માહિતી માટે કૃપા કરીને પરિવારો માટે અમારા [વર્ચ્યુઅલ સ્કૂલ FAQs](#) ની મુલાકાત લો.

માધ્યમિક વર્ચ્યુઅલ શાળા

- ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને દૈનિક સમયપત્રક પ્રાપ્ત થાય છે જે 75 મિનિટના ચાર સમયગાળાના સામાન્ય રીતે ચાર પીરિયડના સમયપત્રકને અને સામાન્ય લંચ પિરિયડને અનુસરે છે.
- દરેક 75 મિનિટના સમયગાળામાં ઓછામાં ઓછા 60 મિનિટનું જીવંત (સુમેળયુક્ત) શિક્ષણ સામેલ હશે.
- શિક્ષણ ઓન્ટારિયો અભ્યાસક્રમને અનુસરશે અને નિયમિત વર્ગખંડ જેવી જ શિક્ષણ પદ્ધતિને અનુસરશે જેમ કે નાના અને મોટા જૂથમાં ભણવાની તકો, વિદ્યાર્થીઓ તેમના શિક્ષક અને સહપાઠીઓ સાથે સંકળાયેલા હોય.
- ફરજિયાત અભ્યાસક્રમો ધોરણ 9-12માં ઓફર કરવામાં આવે છે અને ધોરણ 9-12માં મર્યાદિત સંખ્યામાં વૈકલ્પિક અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. એ નોંધવું અગત્યનું છે કે, કોઈપણ શાળાની જેમ, ચાલુ અભ્યાસક્રમ આયોજનને વિદ્યાર્થીઓની માંગ પ્રભાવિત કરશે અને કદાચ કેટલાક અભ્યાસક્રમો ઓફર કરવામાં ન આવે. માધ્યમિક વર્ચ્યુઅલ શાળા નિયમિત શાળા-વર્ષ કેલેન્ડર ધરાવતી શાળાઓની જેમ જ અભ્યાસક્રમ આયોજન અને સમયરેખાનું પાલન કરશે.
- પરિવારો અને વિદ્યાર્થીઓને **સેકન્ડરી વર્ચ્યુઅલ સ્કૂલ કોર્સ કેલેન્ડર** ની સમીક્ષા કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે કારણ કે એડવાન્સ પ્લેસમેન્ટ, ઇન્ટરનેશનલ બેકલોરેટ, ARTS, SHSM, ફ્રેન્ચ ઇમર્સન સહિતના વૈકલ્પિક વિશિષ્ટ કાર્યક્રમો ઉપલબ્ધ નથી. તમામ વિશિષ્ટ શિક્ષણ વર્ગો ધોરણ 9 -12માં ઉપલબ્ધ છે.
- **વિશિષ્ટ શિક્ષણની જરૂરિયાતો** ધરાવતા વિદ્યાર્થીઓને સહાય કરવી એ બંને શિક્ષણ મોડલમાં પ્રાથમિકતા છે. સ્પેશિયલ એજ્યુકેશન સ્ટાફ બંને મોડલમાં વિદ્યાર્થીઓને સહાય આપવાનું ચાલુ રાખશે. સપ્ટેમ્બરમાં, IEP ધરાવતા વિદ્યાર્થીઓના પરિવારોનો વર્ચ્યુઅલ સ્કૂલ દ્વારા તેમના બાળકના IEP પર પરામર્શ માટે સંપર્ક કરવામાં આવશે. સ્પેશિયલ એજ્યુકેશન કોમ્યુનિટી ક્લાસમાં વિદ્યાર્થીઓના પરિવારોનો તેમની વર્ચ્યુઅલ સ્કૂલ દ્વારા ગૂગલ ક્લાસરૂમ અને ઓન-લાઇન મીટિંગની વિગતો સાથે સંપર્ક કરવામાં આવશે.
- ધોરણ 9 - 12 ના વિદ્યાર્થીઓ તેમના [MyPathway Planner Account](#) દ્વારા બોર્ડ લોગિન દ્વારા સુલભ કરાયેલા અભ્યાસક્રમની માહિતીને વધુ સુલભ કરી શકે છે. એ નોંધવું અગત્યનું છે કે તમામ અભ્યાસક્રમો ઉપલબ્ધ રહેશે નહીં અને તમામ સમયગાળામાં તમામ અભ્યાસક્રમો ઓફર કરવામાં આવતા નથી કારણ કે અભ્યાસક્રમો વિદ્યાર્થીઓની માંગ સહિતની સંખ્યાબંધ પરિવર્તનશીલતા પર આધારિત છે.
- પોસ્ટ-સેકન્ડરી વિકલ્પો વિશે પ્રશ્નો ધરાવતા વિદ્યાર્થીઓ અને પરિવારો કે જેને ચોક્કસ અભ્યાસક્રમોની જરૂર હોય છે તેઓને તેમના વર્તમાન શાળાના માર્ગદર્શક સ્ટાફનો સંપર્ક કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. કોઈપણ અભ્યાસક્રમ પસંદગીના માર્ગના પ્રશ્નોની ચર્ચા કરવા માટે તમામ વિદ્યાર્થીઓ માર્ગદર્શન સ્ટાફ સાથે એપોઇન્ટમેન્ટ લઈ શકે છે.
- મંત્રાલય દ્વારા દર્શાવ્યા મુજબ, વર્ચ્યુઅલ શાળાઓમાં લેવાયેલા અભ્યાસક્રમોનો ઉપયોગ ગ્રેજ્યુએશન માટે જરૂરી બે ઇ-લર્નિંગ કેડિટ્સ માટે કરી શકાતો નથી. આ જરૂરિયાત વિશે વધુ માહિતી આ વસંતઋતુમાં તમામ પરિવારોને જણાવવામાં આવશે.
- કો-ક્યુરિક્યુલર ક્લબ અને ઇવેન્ટ્સ વર્ચ્યુઅલ રીતે ઓફર કરવામાં આવશે.

- યુનિવર્સિટી અથવા કોલેજમાં અરજી કરતા સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ YRDSBની સેકન્ડરી વર્ચ્યુઅલ સ્કૂલ દ્વારા તેમ કરશે અને ડિપ્લોમા પર શાળાનું નામ "YRDSBની સેકન્ડરી વર્ચ્યુઅલ સ્કૂલ" દેખાશે.
- સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ સેકન્ડરી વર્ચ્યુઅલ સ્કૂલ ગ્રેજ્યુએશનમાં હાજરી આપી શકશે.

વધુ માહિતી માટે કૃપા કરીને પરિવારો માટે અમારા વર્ચ્યુઅલ સ્કૂલ FAQs ની મુલાકાત લો.

વર્ચ્યુઅલ સ્કૂલ ટ્રાન્સફર ફોર્મ

વર્ચ્યુઅલ સ્કૂલ ટ્રાન્સફર ફોર્મ યોર્ક રિજન ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ માટે છે જેઓ સમગ્ર 2022-2023 શાળા-વર્ષ માટે પ્રાથમિક અથવા માધ્યમિક વર્ચ્યુઅલ સ્કૂલમાં બદલી કરાવવા માંગે છે. આ ફોર્મ માતા-પિતા/વાલીઓએ ભરવા માટે બનાવાયેલ છે અને YRDSB વર્ચ્યુઅલ સ્કૂલમાં ટ્રાન્સફરની વિનંતી કરતા દરેક બાળક માટે અલગ ટ્રાન્સફર ફોર્મ ભરવું આવશ્યક છે. આ વર્ચ્યુઅલ સ્કૂલ ટ્રાન્સફર ફોર્મ રજૂ કરતા પહેલાં કૃપા કરીને તમારા બાળક સાથે ચર્ચા કરશો.

જે પરિવારોએ નિર્ણય લેવાની જવાબદારીઓ વહેંચી છે તેઓએ આ ફોર્મ ભરતા પહેલાં સંમતિ પર આવવાનું છે. શિક્ષણનું મોડલ પસંદ કરતી વખતે, વિદ્યાર્થીઓ અને પરિવારોએ સંપૂર્ણ શાળા-વર્ષ માટે પસંદ કરેલ મોડેલમાં રહેવાની અપેક્ષા રાખવી જોઈએ. અમે માન્ય કરીએ છીએ કે આ સમયે આ નિર્ણય લેવો પરિવારો માટે પડકારરૂપ હોઈ શકે છે, તેમ છતાં અસરકારક અને સહાયક શાળા સમયપત્રક બનાવવા માટે આ માહિતી જરૂરી છે.

જો તમે ઇચ્છતા હો કે તમે/તમારું બાળક 2022-2023 શાળા વર્ષ માટે પ્રાથમિક અથવા માધ્યમિક વર્ચ્યુઅલ શાળામાં હાજરી આપે તો કૃપા કરીને નીચેનું વર્ચ્યુઅલ સ્કૂલ ટ્રાન્સફર ફોર્મ ભરો.

અગત્યનું: વર્ચ્યુઅલ સ્કૂલ ટ્રાન્સફર ફોર્મ 31 માર્ચથી 7 એપ્રિલ સુધી ખુલ્લું રહેશે.

વર્ચ્યુઅલ સ્કૂલ ટ્રાન્સફર ફોર્મ સબમિટ કર્યા પછી, તમે 2022-2023 શાળા-વર્ષ માટે વર્ચ્યુઅલ લર્નિંગ માટે વર્ચ્યુઅલ સ્કૂલ ટ્રાન્સફર ફોર્મ સબમિટ કર્યું છે તેની પુષ્ટિ કરતો એક ઇમેઇલ પ્રાપ્ત થશે. જો તમને તમારો કન્ફર્મેશન ઇમેઇલ મળે ત્યારે તમને કોઈ ભૂલ જણાય, તો કૃપા કરીને 7 એપ્રિલ, 2022ના રોજ બંધ થાય તે પહેલાં નવું વર્ચ્યુઅલ સ્કૂલ ટ્રાન્સફર ફોર્મ ફરીથી સબમિટ કરશો.

અગત્યનું: સૌથી તાજેતરના સબમિશનનો ઉપયોગ સમગ્ર 2022-2023 શાળા વર્ષ માટે તમારા અંતિમ નિર્ણય તરીકે કરવામાં આવશે.

અગત્યનું: સમગ્ર 2022-2023 શાળા વર્ષ માટે રૂબરૂ હાજરી આપનાર વિદ્યાર્થી માટે કોઈ સબમિશનની જરૂર નથી. અમે જાણીએ છીએ કે પરિવારો પાસે શાળામાં પાછા ફરવા વિશે ઘણા પ્રશ્નો છે, અને જેમ જેમ તે ઉપલબ્ધ થશે તેમ અમે તમારી સાથે માહિતી સહિયારી કરવાનું યાલુ રાખીશું અને www.yrdsb.ca/school-reopening પર અમારી બોર્ડની વેબસાઇટ પર માહિતી, વીડિયો અને સંસાધનો શેર કરવાનું યાલુ રાખીશું.

**આ ફોર્મ પર એકત્રિત કરવામાં આવેલી માહિતી શિક્ષણ અધિનિયમ R.S.O.ની સત્તા હેઠળ એકત્રિત કરવામાં આવી છે. 1990, c E.2, s.8.1, અને અમારી શાળાઓના સામાન્ય વહીવટ માટે યોર્ક રિજન ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ દ્વારા ઉપયોગમાં લેવાશે. આ ફોર્મ પર એકત્રિત કરવામાં આવેલી તમામ વ્યક્તિગત માહિતી મ્યુનિસિપલ ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ



THE EDUCATION CENTRE - AURORA

60 Wellington Street West, Aurora, Ontario L4G 3H2

ટેલિફોન: 905.722.3201 905.895.7216 905.727.3141 416.969.8131

ફેક્સ 905.727.1931

Website: www.yrdsb.ca

પ્રોટેક્શન ઓફ પ્રાઇવસી એક્ટ, R.S.O., 1990, c અનુસાર જાળવવામાં આવશે. M.56, s. 29. આ ફોર્મ પરની માહિતીના સંગ્રહને લગતા કોઈપણ પ્રશ્નો research.services@yrdsb.ca પર મોકલી શકાય છે.